

Date: 03rd February, 2022

To,	To,
National Stock Exchange of India Limited	BSE Limited
Exchange Plaza, Plot C-1, 'G' Block,	Phiroze Jeejeebhoy Towers,
ISB Centre, Bandra-Kurla Complex,	Dalal Street, Fort,
Bandra (East), Mumbai-400 051.	Mumbai - 400 001.
Company Code No. NKIND	Company Code No. 519494

Dear Sir/Madam,

Sub: <u>Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements)</u> <u>Regulations, 2015</u>

With reference to the subject referred Regulation, we would like to inform you that Extract of Unaudited Financial Results for the quarter ended 31st December, 2021 has been published in the Financial Express Newspaper (English) & Financial Express Newspaper (Gujarati) on 02nd February, 2022.

A copy of the said newspaper advertisement is enclosed for your reference and record.

You are requested to take the same on records.

Thanking You.

Yours faithfully, N K INDUSTRIES LIMITED

Pooja H. Khakhi Company Secretary & Compliance Officer

Regd. Office : 7th Floor, Popular House, Ashram Road, Ahmedabad - 380 009. India. Phone : 91-79-66309999 Fax : 91-79-26589214 E-mail : nkil@nkproteins.com Plant : 745, Kadi-Thor Road, Kadi - 382 715. Dist. Mehsana (N.G.) Tele : (02764) 242613, 263884 Fax : (02764) 263667 Email : nkilkadi@yahoo.co.in

CIN No. : L91110GJ1987PLC009905

1

10 1 1 1

FINANCIAL EXPRESS



HBL POWER SYSTEMS LIMITED HBL CIN:L40109TG1986PLC006745 Regd. Off: 8-2-601, Road No.10, Banjara Hills, Hyderabad – 500 034 NOTICE

Notice is hereby given that pursuant to Regulation 29 and 30 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, it is hereby informed that a meeting of the Board of Directors of the Company will be held on Saturday, February 12, 2022 inter-alia to consider and to take on record unaudited (standalone/consolidated) financial results for quarter ended December 31, 2021 pursuant to SEBI (LODR) Regulations, 2015. For HBL Power Systems Limited

Sd/- MVSS Kumar

Company Secretary

Registered office: 1st Floor, August Kranti Bhawan,

Bhikaji Cama Place, R. K. Puram, New Delhi,

South Delhi- 110066, CIN: L74999DL2003G0I118633

Email: investors@rvnl.org

Phone No.: 011-26738299, Fax: 011-26182957

Place : Hyderabad Date : 01/02/2022



NOTICE Notice is hereby given pursuant to Regulation 29, 33 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, ("Listing Regulations") that a meeting of Board of Directors of the Company will be held on Wednesday, 09th February, 2022, through video conferencing to consider, approve and take on record the Unaudited Financial Results (Standalone and Consolidated) of the Company for

the quarter and nine months ended 31st December, 2021. Further, pursuant to the "RVNL code of conduct for regulating and reporting trading by Designated Persons and their immediate relatives" the Trading Window Closure Period has commenced from 1st January, 2022 and will end 48 hours after the financial results are made public on 09th February, 2022.

The intimation contained in this notice is also available on website of the Company at www.rvnl.org and website of stock exchanges where the shares of the Company are listed at www.bseindia.com and www.nseindia.com.

Place: New Delhi	For Rail Vikas Nigam Limited Sd/-
Date: 01.02.2022	Deepika Mehta
	Company Secretary & Compliance Officer

ORDS CABLE INDUSTRIES LIMITED

Regd. Off. : 94, 1st Floor, Shambhu Dayal Bagh Marg, Near Okhla Industrial Area Phase-III, Old Ishwar Nagar, New Delhi-20, Tel: 011-40551200 *Fax No.011-40551280/81 *Website: www.cordscable.com, E-mail: ccil@cordscable.com *CIN L74999DL1991PLC046092 NOTICE

Notice is hereby given, pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that 201st meeting of the Board of Directors of the Company is scheduled to be held on Monday, February 14, 2022 at 12:00 noon onwards to consider and approve, inter alia, The Un-audited Financial Results along with Limited Review Report by the statutory auditor for the 3rd Quarter/ 9 months ended on December 31, 2021 and other items as per agenda.

The above information is also available on the website of the company viz. (www.cordscable.com) and the websites of the Stock Exchanges where Company's shares are listed viz. (www.bseindia.com) and (www.nseindia.com).In accordance with the SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015, the Trading Window for dealing in the securities of the Company has already been closed for all the designated persons and their immediate relatives w.e.f January 01, 2022 till 48 hours after the un-audited Financial Results for the 3rd Quarter/9 months ended on December 31st, 2021 is made public.

By order of the Board of Directors For Cords Cable Industries Limited

Keshav Shri Keshav Cements and Infra Ltd. CEMENT [Formerly : Katwa Udyog Limited]

Registered Office : Jvoti Towers, 215/2, Karbhar Galli, Nazar Camp, Vadgaon, Belagavi - 590 005. Ph.: 0831 - 2483510; 2484412. Email: info@keshavcement.com, Website : www.keshavcement.com

NOTICE

Pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that a Meeting of the Board of Directors of the company will be held on Tuesday, 08th February, 2022, at 11.00 a.m. at its Registered office of the Company, interalia, to consider and approve the Unaudited Financial Results for the Quarter Ended 31" December, 2021.

The above information is also available on the website of the Company at www.keshavcement.com and also at the website of The Bombay Stock Exchange (BSE) at www.bseindia.com Place: Belagavi For Shri Keshav Cements and Infra Limited Date: 01.02.2022 Sd/-Venkatesh Katwa Chairman DIN: 00211504 ANAND ADS SKB Roop Commercial LLP (LLP IN AAB-4607)

> Registered Offfice: 106-107, 10th Floor, Bajaj Bhawan, Nariman Point, Mumbai -400021

Email id: sheetals@bajajrealty.co.in; Tele No. 22 22023626 Fax :22022238

PUBLIC NOTICE FOR SHIFTING OF REGISTERED OFFICE OF LLP Notice is hereby given to the General Public that SKB Roop Commercial LLP ("the LLP") proposes to shift its registered office from the State of Maharashtra to National Capital Territory (NCT) of Delhi and shall file an application with Registrar of Companies, Maharashtra, Mumbai under section 13 (3) of the Limited Liability Partnership Act, 2008 read with rule 17 of the Limited Liability Partnership Rules, 2009 in form No. 15, seeking permission to shift its Registered office from the State of Maharashtra to National Capital Territory (NCT) of Delhi.

Any person whose interest is likely to be affected by the proposed change of the registered office of the LLP may deliver or cause to be delivered or send by Registered post of his/her objections supported by an affidavit stating the nature of his/her interest and grounds of opposition supported by an affidavit to the Registrar of Companies, Maharashtra Mumbai, 100, Everest Building, New Manine Lines, Mumbai - 400 002 within 21(twenty one) days from the date of publication of this notice with a copy to the petitioner LLP at its registered office at the address mentioned above.

For and on behalf of SKB Roop Commercial LLP Sd/-Rajiv Gandhi (Designated Partner) DIN: 00041707 106-107, 10th Floor, Bajaj Bhawan, Dated: February 02 ,2022 Nariman Point, Mumbai -400021



N. K. Industries Limited

Registered Office: 7th Floor, Popular House, Ashram Road Ahmedabad - 380 009 Work: 745, Kadi-Thor road, Kadi - 382 715 Dist. : Mehsana (North Gujarat) E-mail: nkil@nkproteins.com, Web: www.nkindustriesItd.com CIN: L91110GJ1987PLC009905, Ph.: +91-79-6630 9999

Extracts of unaudited Standalone and Consolidated Financial Results for the guarter ended on 31st December, 2021

		Standalone			Consolidated	(Rs. In lacs
Particulars	Quarter ended 31/12/2021	Quarter ended 31/12/2020	Year ended 31/03/2021	Quarter ended 31/12/2021		Year ended 31/03/2021
Total income from operations (net)	70.74	40.66	282.69	525.36	521.94	2256.66
Net Profit/(Loss) (before Extraordinary activities after tax)	(51.83)	(132.30)	(232.38)	(36.63)	(163.71)	(226.13)
Net Profit/(Loss) for the period after tax (after Extraordinary items)	(51.83)	(132.30)	(232.38)	(36.63)	(163.71)	(226.13)
Equity Share Capital	600.99	600.99	600.99	600.99	600.99	600.99
Earnings Per Share (before extraordinary items) of Rs.10/- each Basic: Diluted:	(0.86)	(2.20)	(3.87)	(0.61)	(2.79)	(3.76)
Earnings Per Share (after extraordinary items) of Rs.10/- each Basic: Diluted:	(0.86)	(2.20)	(3.87)	(0.61)	(2.79)	(3.76)

Note:

The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Quarterly Financial Results are available on the Stock Exchange websites. (URL: http://www.bseindia.com/corporates/ann.aspx?scrip=519494&dur=A&expandable=0)

	For and on behalf of Board of Directors
	N. K. Industries Limited
	Sd/-
Date: 1 st February, 2022	Mr. Nimish K. Patel
Place: Ahmedabad	Managing Director



("Formerly IDFC Infrastructure Finance Limited")


Registered Office: North Wing, 3" Floor, UTI Tower, GN Block, Bandra Kurla Complex, Mumbai - 400 051, Maharashtra, CIN No: U67190MH2014PLC253944 Website: www.niififl.in Tel. No: +91 22 68591300.

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE NINE MONTHS ENDED DECEMBER 31, 2021

Place : New Delhi Date : February 01, 2022	Comp
---	------

Sd/-**Garima Pant** pany Secretary

Place: Mumbai



Sr. No.	Particulars	Nine Months ended December 31, 2021	Nine Months ended December 31, 2020	Year ended March 31, 2021
		(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total Income from Operations	69,794	53,382	71,475
2	Net Profit /(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	17,805	10,173	13,175
3	Net Profit /(Loss) for the period before tax (after exceptional and/or Extraordinary items)	17,805	10,173	13,175
4	Net Profit /(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary items)	17,805	10,173	13,175
5	Total Comprehensive Income for the period [comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	17,832	10,181	13,210
6	Paid-up equity share capital including redeemable preference shares	1,10,038	69,235	1,10,038
7	Reserves (excluding revaluation reserves)	94,790	49,293	76,960
8	Net Worth	2,04,828	1,18,527	1,86,998
9	Paid-up Debt Capital/Outstanding Debt	9,63,461	6,71,224	7,36,993
10	Outstanding Redeemable Preference Shares	Nil	Nil	Ni
11	Debt Equity Ratio	4.70	5.66	3.94
12	Earnings per share (of ₹ 10/- each) (for continuing and discontinuing operations) (not annualised)			
	Basic (₹)	1.78	1.53	1.96
	Diluted (₹)	1.78	1.53	1.96
13	Capital Redemption Reserve/Debenture Redemption Reserve	Nil	Nil	Ni

1 The above is an extract of detailed format of Nine month ended financial results filed with the Stock Exchange under Regulation 52 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the yearly financial results is available on www.nseindia.com & www.niififl.in. The above financial results of the Company have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 ("Ind AS") prescribed under Section 133 of the Companies Act, 2013. The Company has adopted Ind AS from April 1, 2018 with a transition date of April 1, 2017.

- 2 The aforesaid financial results of the Company were reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on January 31, 2022.
- 3 The debentures of the Company have been assigned rating of "AAA" by ICRA Limited & CARE Ratings Limited.
- 4 The Company is registered as Infrastructure Debt Fund (IDF-NBFC) with RBI. As per Section 10(47) of the Income Tax Act, any income of IDFs notified by Central Board of Direct Taxes (CBDT) for this purpose under Section 10(47) is exempt from income tax. The Company had filed application with Central Board of Direct Taxes (CBDT) for notification as Infrastructure Debt Fund (IDF) from Financial year 2014-15, the year of receipt of licence from RBI as NBFC-IDF, and has been claiming tax exemption under Section 10(47) read with Rule 2F of the Income Tax Act.

The CBDT has issued a notification dated October 21, 2019 notifying the Company under Section 10(47) of the Income Tax Act w.e.f. Financial year 2019-20 (i.e from the financial year starting 1st April 2019).

The Company has made an application to CBDT for review of the said notification with a request to notify it under Section 10(47) of Income Tax Act with retrospective effect, i.e. w.e.f. Financial year 2014-15 (the year in which it received RBI registration as NBFC-IDF). In the interim, the tax liability from Financial year 2014-15 till financial year 2018-19 amounting to ₹ 10,801 lakhs has been provided for in the financial of previous year ending March 31, 2020.

5 The Company continues to closely monitor the situation and in response to this health crisis has implemented protocols and processes to execute its business continuity plans and help protect its employees and support its clients. The Company continues to meet its operating and financial obligations, maintained required capital adequacy ratio and has adequate financial resources to run its business and has not experienced any significant disruptions due to this pandemic. The company has considered the impact on carrying value of assets based on the external or internal information available up to the date of approval of financial statements. However, the extent to which COVID-19 pandemic will continue to impact the Company's business, operations, financial position and cash flows will depend on future developments which remains uncertain, including, among other things, any information concerning the severity of any new COVID variant. Based on current indicators of future economic conditions, the Company expects to recover the carrying amount of the financial assets. The Company is also closely monitoring any material changes in the economic conditions and resultant impacts, if any, on the expected credit loss provisions.

6 The figures for previous period/year have been regrouped wherever required, to correspond with those of the current period/year.

For and on behalf of the Board of NIIF Infrastructure Finance Limited

Date: January 31, 2022 Place: Mumbai

Debt-Equity Ratio The Debt-equity Ratio as on December 31, 2021 is 4.70. Current Ratio The Current Ratio as on December 31, 2021 is Not applicable. Outstanding redeemable preference shares (quantity and value) NIL Long Term Debt to Working Capital Long Term Debt to Working Capital as on December 31, 2021 is Not applicable. Bad Debts to Account Receivable Ratio Bad Debts to Account Receivable Ratio as on December 31, 2021 is Not applicable. Current Liability Ratio Current Liability Ratio as on December 31, 2021 is Not applicable. Total Debts to Total Assets Total Debts to Total Assets as on December 31, 2021 is 82.33%. Debtors Turnover Not applicable Inventory Turnover Not applicable **Operating Margin (%)** Operating Margin as on December 31, 2021 is 25.55%. Net Profit Margin (%) Net Profit Margin as on December 31, 2021 is 25.38%. Net Worth The net worth as of December 31, 2021 is ₹ 2,04,828 lakhs. Capital Adequacy The capital adequacy is 20.56% as of December 31, 2021. Net Profit After Tax The net profit after tax for the year ending December 31, 2021 is ₹ 17,805 lakhs. Earnings Per Share The earning per share (Basic & Diluted) for the year ending December 31, 2021 is ₹ 1.78. Gross/ Net Non-Performing Assets (NPAs) There are no NPAs as of December 31, 2021. Capital Redemption Reserve/Debenture Redemption Reserve Not applicable, being a Non-Banking Financial Service Company registered with the Reserve Bank of India.

Sd/-Surya Prakash Rao Pendyala Chairman

	Chember, Mamber 400011	repayment of total dues	(Symbolic)				
	Details of Mortgaged Property: Flat No. 501, 5 th Floor, A Wing, Shree Ganesh CHSL New Mhada Colony, Kamgar Nagar, Plot Bearing CTS No. 48/A/3 of Revenue Village Chembur, Taluka Kurla, Kurla East, Mumbai 400071. Admeasuring:- 571.57 Sq. Ft Carpet Area						
7 1) Vinita A Patil, 2) Rutuja A Patil, Both At : A Wing, 1202, Sec 54, Plot No. 5, Juhi Residency, Kamothe, Navi Mumbai-410209, Also At : Unit No. 1604, 1605, 1606, 16th Floor, Block B, Arihant Aura, Plot No.		Rs. 2,51,89,177/- (Rupees Two Crore Fifty One Lakh Eighty Nine Thousand One Hundred Seventy Seven Only) as on 05/08/2021 (including interest applied till	06/08/2021				
	131, Village Turbhe, MIDC, Navi Mumbai-400703	05/08/2021 only) plus further interest (at contractual rate of interest) from 05/08/2021 thereon till the date of repayment of total dues	27/01/2022 (Symbolic)				
A COLORADORA	Details of Mortgaged Property: Unit No. 1604, 1605, 1606, 16th Floor 400703. Area Admeasuring : 66.25 Sq. mtrs Built Up Area (Unit No. 1604 Area (Unit No. 1606),						
	1. Sanjeev Lodha, 2. Archana Lodha, Flat No. 4 B & C, 4th Floor, Dreamland Bldg., Near Panchratna Tower / Proxi Cinema New Queens Road, Charni Road, Mumbai 400004 And Also At : Flat No. 26 / 27, 3rd	Rs. 2,21,83,994/- (Rupees Two Crore Twenty One Lakh Eighty Three Thousand Nine Hundred & Ninety Four Only) as on 05/08/2021 (including interest –	06/08/2021				
	Floor, 198 Kambekar Street, Mumbai 400003	applied till 05/08/2021 only) plus further interest (at contractual rate of interest) From 05/08/2021 thereon till the date of repayment of total dues	28/01/2022 (Symbolic)				
	Details of Mortgaged Property: Flat No. 4 B & C, 4th Floor, Dreamland Bldg, Near Panchratna Tower / Proxi, Cinema New Queens Road, Charni Roa d, Mumbai 400004. Admeasuring:- 1900 Sq. Ft. Carpet Area						
	Mumbar+00004. Aumeasuning 1900 Sq. Ft. CarpetArea						
1	1) Navin Vanvir Shah, 2) Meena Navin Shah, 3) Nishit Navin Shah, All At : Flat No. 61 & 62, Prabha Mandir CHS, Prabha Nagar, P Balu	Rs. 5,27,63,559/- (Rupees Five Crore Twenty Seven Lakhs Sixty Three Thousand Five Hundred & Fifty Nine Only) as on 14/09/2021 (including interest	20/09/2021				
	1) Navin Vanvir Shah, 2) Meena Navin Shah, 3) Nishit Navin Shah,		20/09/2021 28/01/2022 (Symbolic)				
9	1) Navin Vanvir Shah, 2) Meena Navin Shah, 3) Nishit Navin Shah, All At : Flat No. 61 & 62, Prabha Mandir CHS, Prabha Nagar, P Balu	Lakhs Sixty Three Thousand Five Hundred & Fifty Nine Only) as on 14/09/2021 (including interest – applied till 14/09/2021 only) plus further interest (at contractual rate of interest) From 14/09/2021 thereon till the date of repayment of total dues he Building Known as 'Prabha Mandir Co-Operative Hous No. 1/1649 and 1650(PT) and C.S. No, 25 and Final Plot him Division In the Mumbai City, Located at Prabhanag ongwith One Car Parking Space. & ndir Co-Operative Housing Society Ltd.', Lying and Bein C.S. No, 25 and Final Plot No. 1216 of Town Planning So	28/01/2022 (Symbolic) sing Society Ltd.' No. 1216 of Towr jar, P Balu Marg g Situated on the cheme No. IV and				









Ahmedabad 🏾

Adfactors 554

ફાયનાન્સિયલ એક્સપ્રેસ



શોપ નં. ૧ થી ૫, નિસ્મલ પ્લાઝા, તળાજા રોડ, સંસ્કાર મંડળ પાસે, ભાવનગર-૩૬૪૦૦૨ ફોન : ૦૦૨૭૮-૨૫૭૦૧૭૦ ઇ-મેલ : B775@indianbank.co.in इंडियन बैंक \delta Indian Bank ALLAHABAD 🛕 इलाहाबाद સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિચમો ૨૦૦૨ના નિચમ ૮(૧) હેઠળ કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે) આથી સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિચમો, ૨૦૦૨ની (નિચમ ૩, ૮, ૯ સાથે વંચાતી) કલમ ૧૩ (૧૨) હેઠળ પ્રાપ્ત સત્તાની રૂએ નીચે સહી કરનાર **ઇન્ડિયન બેંક (ર્શ-અલાહાબાદ બેંક)ના** અધિકૃત અધિકારીએ **તા. ૨૦.૦૪.૨૦૨૧ ના રોજ** માંગણા નોટિસ જારી કરી દેવાદાર **શ્રી** કાળુભાઈ નાથાભાઈ સોલંકી અને શ્રી સાહિદ કાલુભાઈ સોલંકી (દેવાદાર/ગીસ્વેદાર), અહેમદભાઈ અલીભાઈ માંડવિચા અને સલિમભાઈ ઈરમાઈલભાઈ માંડવિચા (જામીનદાર) ને માંગણા નોટીસમા જણાવેલ **તા. ૧૯.૦૪.૨૦૨૧ મુજબની** ૨કમ **રૂા. ૧૦,૯૬,૪૦૫.૦૦ (રૂપિયા દસ લાખ છજ્ઞું હજાર ચારસો પાંચ પુરા)** જણાવેલ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું. દેવાદારો / જામીનદારો / ગીરવેદાર રકમ પરત ચુકવવામાં નિષ્ફળ જતાં આથી દેવાદારો / ભમીનદારો / ગીરવેદારો અને ભહેર જનતાને આ નોટિસથી ભણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે કથિત નિયમોના નિયમ ૩ . ૮ . ૯ સાથે વંચાતી કાયદાની કલમ ૧૩(૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાની રૂએ નીચે દશવિલી મિલક્તનો **તારીખ ૨૯.૦૧.૨૦૨૨ ના રોજ**

કલનો લઈ લીધો છે. ਆਈ ખાસ કરીને દેવાદારો / જામીનદારો / ગીરવેદાર અને જાહેર જનતાને મિલક્ત સાથે કોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ સોદો **ઇન્ડિયન બેંક (ઇ-અલાહાબાદ બેંક), હિલ ડ્રાઇવ ભાવનગર શાખા**ની તા. ૧૯.૦૪.૨૦૨૧ મુજબની ૨કમ રૂા. ૧૦,૯૬,૪૦૫.૦૦ (રૂપિયા દસ લાખ છક્ષું હજાર **ચારસો પાંચ પુરા)** અને તેના પરના ભવિષ્યના વ્યાજ અને ખર્ચાના ચાર્જને આદ્યિન રહેશે. સિક્યોર્ડ મિલકતો પરત મેળવવા માટે ઉપલબ્ધ સમય અંગે કાયદાની કલમ ૧૩ની પેટા કલમ (૮)ની જોગવાઈ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

સ્થાવર મિલકતનું વર્ષન ગીરો મિલકતો: ગુજરાત રાજ્યમાં કાળાનાળા, ઉપ્પેરોટ, નાનભાવાડી રોડ, ભાવનગર ખાતે વોર્ડ નં. ૭ ની શીટ નં. ૧૮૯ , સર્વે નં. ૧૦૭૦/૧ થી ૧૦૭૦/૪ ધરાવતી રવમાલિકીની

જમીન પર બંધાચેલ સ્ટલીંગ કોમ્પલેક્ષના પહેલા માળે દુપ.૪૦ ચો.મી.માપના ફ્લેટ નં. પ ની સ્થાવર મિલકતના તમામ પીસ અને પાર્સલ. **રેકોર્ડ પ્રમાણે ચલઃસીમા : પર્વ :** કોમન પેસેજ અને સીડીઓ, **પશ્ચિમ :** ફ્લેટ નં. 3, ઉત્તર : કોમન પેસેજ અને ઓટીએસ , દક્ષિણ ਮਾર্જਿ ਰਚ ਕਾਰੋਗ ਅਰੇ ਆਫੇਟ ਦੀ ਤ

તારીખ : ૨૯.૦૧.૨૦૨૨ ક્ષળ : ભાવગગ્ર

સહી/-

એક્સીસ બેંક લીમીટેડ

(CIN : L65110GJ1993PLC020769) સ્ટ્રક્ચર્ડ એસેટ્સ ગ્રુપ, કોર્પોસ્ટ ઓફીસ, એક્સીસ હાઉસ, સાતમો માળ, સી–૨, વાડિયા ઇન્ટરનેશનલ સેન્ટર, પાંડુરંગ બુધકર માર્ગ, વરલી, મુંબઇ-૪૦૦૦૨૫ ફોન : +૯૧ ૯૯૨૦૦૮૫૩૮૫ www.axisbank.com

ચીક મેનેજર અને અધિકૃત અધિકારી

ସଙ୍କିଥକ ର୍ଭିନ (ସ-ଅଗାଡାରାଜ ର୍ଭନ) ସମା

કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

આથી એક્સીસ બેંક લીમીટેડના નીચે સહી કરના૨ અધિકૃત અધિકારીએ સિક્ચોરીટાઇઝેશન અને રીકબ્લ્ટૂડબા ઓન્ડ સિન્સોરીટી ઇન્ડરેસ્ટ (એક્ટ્ર), ૨૦૦૨ (૨૦૦૨ નો ૫૪) (અહીં પછે સરક્રેસી એક્ટ તરીકે વાર્ણવેલછે) હેઠળ અને સિન્સોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિચમો, ૨૦૦૨ના નિચમ ૩ સાથે વંચાતી કલમ ૧૩ (૧૨) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને તા.૧૦.૧૧.૨૦૨૧ ના રોજમાંગણા નોટીસ જારી કરી દેવાદાર/જામીનદારો/ગીરવેદાર એટલે કે ૧ મેસર્સ શ્રી કૃષ્ણા મેટલ્સ, ૨. શ્રી દિપકકુમાર લાલાપ્રસાદ શાહ, ૩. શ્રી અશોક લાલાપ્રસાદ શાહ અને ૪. શ્રી લાલાપ્રસાદ જાનકીલાલ શાહને નીચે નોટીસમાં જણાવેલ ૨કમ રૂા.૫,૫૫,૨૬,૨૧૨.૧૦/− (૨ પિચા પાંચ કરોડ પંચાવન લાખ છવ્વીસ હજાર બસો બાર અને દસ પૈસા પુરા) ૩૦.૦૯.૨૦૨૧ મુજબની બાકી નિકળતી ૨કમ તેમજ૦૧.૧૦.૨૦૨૧ થી માસિક દરે ચુકવવાપાત્ર/ચક્રવૃદ્ધિ કરારન દંરે ચડત વ્યાજતેમજતેના પર કરારના દરે ચડત વ્યાજઆ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની

અંદર ચુકવવા જણાવ્યું હતું. દેવાદાર, જામીનદારો,ગીરવેદારો ૨કમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી મિલકતના દેવાદાર,જામીનદારો અને જાહેર જ્નતાને જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ સાથે વંચાતી કલમ ૧૩ ની પેટા કલમ (૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે જણાવેલ મિલકતનો કબજો આ ૨૮ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ લઇ લીધો છે.

માસ કરીને ઉપર જણાવેલ દેવાદારો/જામીનદારો/ગીરવેદારો અને જાહેર જનતાને મિલક્ત સાથે કોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ સોદો એક્સીસ બેંક લીમીટેડની સિક્યોર્ડ લેણાંની ૨કમ રૂા.૫,૫૫,૨૬,૨૧૨.૧૦/– (રૂપિયા પાંચ કરોડ પંચાવન લાખ છવ્વીસ હજાર બસો બાર અને દસ પૈસા પુરા) ૩૦.૦૯.૨૦૨૧ મુજબની બાકી નિકળતી રકમ તેમજ ૦-૧.૧૦.૨૦૨૧ થી માસિક દરે ચુક્વવાપાર્ગ (ચક્રવુદ્ધિ કરારના દરે ચડત વ્યાજતેમજધિર જણાવે તારીખ ૧૦.૧૧.૨૦૨૧ નીમાંગણા નોટીસ મુજબ ચુકવણીની તારીખ સુધી તેના પર કરારના દરે ચડત વ્યાજ વગેરેના ચાર્જને આધિન રહેશે.

સિક્યોર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબ્ધ સમય મર્ચાદાના સબંધમાં એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮)ની જોગવાઇઓ પ્રત્યે દેવાદાર/જામીનદારો/ગીરવેદારોનું ધ્યાન દોરવામાં આવે છે. મેસર્સ શ્રીકૃષ્ણા મેટલ્સ દ્વારા લેવાચેલ ક્રેડીટ સવલતો માટે સિક્ચોર્ડ સ્થાવર મિલક્તોની વિગત

૧. સબ પ્લોટ નં. એ-૧૭. ક્ષેત્રકળ ૧૩૮૯.૦૧ ચો.મી.. (પ્લોટ એરિયા) તેમજ ન વહેચાયેલ હિસ્સો ક્ષેત્રફળ ૩૬૮.૩૭ ચો.મી., બ્લોક નં. ૧૨૮૬ (જૂનો બ્લોક નં. ૧૫૦), મોજે કઠવાડા, તાલુકો દસ્કોઇ જિલો અમદાવાદ ખાતેની સ્થાવર મિલક્તોના તમામ ભાગ અને હિસ્સા ચતુઃસીમાઃ

પુર્વે: સબ પ્લોટ નં. એ/૧૮, પશ્ચિમ: સબ પ્લોટ નં. એ–૧૬, દક્ષિણ:સબ પ્લોટ નં. એ–૧૨, એ–૧૩, ઉત્તર: રોડ

. રેસીડેન્સીચલ ફ્લેટ નં. ૨૦૧, ક્ષેત્ર ફળ ૧૪૪.૬૪ ચો.મી. (સુપર બિલ્ટ અપ એરિચા), બીજો માળ સેતુકૃપા ઓનર્સ એસોસિચેશનની સેતુકૃપા એપાર્ટમેન્ટ તરી કે જાણીતી સ્કીમમાં, ફાઈનલ પ્લોટ નં મલ, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૧૪, મોજેેેેેેે દરિયાપુર−કાઝીપુર, તાલુકો અસારવા જિલોઅમદાવા3દ ખાતેની સ્થાવર મિલક્તના તમામ ભાગ અને હિસ્સા.

ચતુઃસીમાઃ પુર્વ: રોડ, માર્જિન પ્લેસ, પશ્ચિમ: ફ્લેટનં. ૨૦૪, દક્ષિણ: ફ્લેટ નં. ૨૦૨, કોમન રોડ, કેત્તર: પંચવટી સોસાચટી અને ડાભી સઢી/

સ્થળ : અમદાવાદ તારીખ : ૦૨.૦૨.૨૦૨૨



G

આથી સિક્યોરીટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાચનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિચમો, ૨૦૦૨ની (નિચમ ૩, ૮, ૯ સાથે વંચાતી) ક્લમ ૧૩ (૧૨) હેઠળ પ્રાપ્ત સત્તાની રૂએ નીચે સહી કરનાર **ઇન્ડિયન બેંકના** અધિકૃત અધિકારીએ **તા.** 30.00.૨૦૨૧ ના રોજ માંગણા નોટિસ ભારી કરી દેવાદાર મે. ક્લાસિક એન્ટરપ્રાછપ્રીસ પ્રોપરાચટર શ્રી મોઢમ્મદ હનીફ ઉસ્માનભાઈ શેખ (દેવાદાર), શ્રી મોઢમ્મદ હનીફ કેરમાનભાઈ તે શ્રી ઉરમાન અબ્દુલભાઇ શેખ (ગીરવેદાર) નાં પુત્ર અને શ્રી અલ્તાફ **સુલેમાનભાઈ શેખ તે શ્રી સુલેમાનભાઈ (જામીનદાર) ના પુત્ર**ને માંગણા નોટીસમા જણાવેલ **તા**. ૨૦.૦૫.૨૦૨૧ મુજબની ૨કમ રૂા. ૬,૫७,૫૯૬.૦૦ (રૂપિયા નવ લાખ સત્તાવન હજાર પાંચસો નવ્વાણુ પુરા) જણાવેલ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું. દેવાદારો / જામીનદારો / ગીરવેદાર રકમ પરત ચુકવવામાં નિષ્ફળ જતાં આથી દેવાદારો જામીનદારો / ગીરવેદારો અને જાહેર જનતાને આ નોટિસથી જાણ કરવામાં આવે છે કે નીર સહી કરનારે કથિત નિયમોના નિયમ 3, ૮, ૯ સાથે વંચાતી કાયદાની કલમ ૧૩(૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાની રૂએ નીચે દર્શાવેલી મિલક્તનો **તારીખ ૨૯.૦૧.૨૦૨૨ ના રોજ કબજો** લઈ લીધો છે.

આથી ખાસ કરીને દેવાદારો / જામીનદારો / ગીરવેદાર અને જાહેર જનતાને મિલક્ત સાથે કોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલક્ત સાથેનો કોઇપણ સોદો **ઇન્ડિયન** બેંક ભાવનગર શાખાની તા. ૨૦.૦૫.૨૦૨૧ મુજબની ૨કમ રૂા. ૯,૫७,૫૯૯.૦૦ (રૂપિયા નવ લાખ સત્તાવન હજાર પાંચસો નવ્વાણુ પુરા) અને તેના પરના ભવિષ્યના વ્યાજ અને ખર્ચાના ચાર્જને આદ્વિન રહેશે.

સિક્ચોર્ડ મિલકતો પરત મેળવવા માટે ઉપલબ્ધ સમય અંગે કાયદાની કલમ ૧૩ની પેટા કલમ (૮)ની જોગવાઈ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

સ્થાવર મિલકતોનું વર્ણન

ગીરો મિલકતો:- ગુજરાત રાજ્યમાં ભાવનગરના વોર્ડ નં.૨, શીટ નં.૮૩, સિટી સર્વે નં ૧૬૪૧ (એક્ફિત સર્વે નં. ૧૬૪૧ થી ૧૬૪૬), સિદ્દીવાડ, વડવા ખાતે રૂખસાના પાર્કના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત ૧૪.૨૪ ચો.મી.માપની દુકાન નં.૪. **ચતુઃસીમાઃ ઉત્તરઃ** દુકાન નં. 3 , દક્ષિણઃ બહેર રોડ , પૂર્વઃ રૂખસાના પાર્કની ખુલ્લી જગ્યા , પશ્ચિમઃ બહેર રોડ. લાઇપોથીકેટેક મિલકતો :- સમગ્ર સ્ટોક, ચોપડે દેવાઓ અને પેઢીની વર્તમાનની અને ભવિષ્ય બંનેની અન્થ તમામ ચાલુ મિલક્તો પરનુ વિશિષ્ટ હાઇપોથીકેશન. ଅଣି/ ચીફ મેનેજર અને અધિકૃત અધિકારી, ઇન્ડિયન બેંક કેમ્પ ભાવનગર ખાતે તારીખ : ૨૯.૦૧.૨૦૨૨ ક્લાપા : ભાલભાગક

શોપ નં. ૧ થી પ, નિસ્મલ પ્લાઝા, તળાજા રોડ, સંસ્કાર મંડળ પાસે, ભાવનગર-૩ક૪૦૦૨ ફોન : ૦૦૨७૮-૨૫७૦૧७૦ ઇ-મેલ : B775@Indianbank.co.in इंडियन बैंक 🧟 Indian Bank 🛆 इसाहाबाद ALLAHABAD સેક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ના નિયમ ૮(૧) હેઠળ કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

આથી સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) નિયમો. ૨૦૦૨ની (નિયમ ૩. ૮. ૯ સાથે વંચાતી) કલમ ૧૩ (૧૨) હેઠળ પ્રાપ્ત સત્તાની રૂએ નીચે સહી કરનાર **ઇન્ડિયન બેંક (ઈ-અલાહાબાદ બેંક)ના** અધિકૃત અધિકારીએ **તા. ૨૦.૦૪.૨૦૨૧ ના રોજ** માંગણા નોટિસ ભારી કરી દેવાદાર મે. વિરાજ આઇસ ઝોન (પ્રો.) શ્રીમતી મંજુલાબેન અશોકભાઇ રોઢિડા (દેવાદાર / ગીરવેદાર), શ્રી અશોકકુમાર ક્લેચાલાલ રોહિડા અને શ્રી કિશનકુમાર ગોરધનદાસ **તલરેજા (જામીનદાર)**ને માંગણા નોટીસમા જણાવેલ **તા. ૧૯.૦૪.૨૦૨૧ મુજબની** ૨કમ **રા. ૧૪,૪૧,૦૧૮.૦૦ (રૂપિયા ચૌદ લાખ એકતાળીસ હજાર અઢાર પુરા)** જણાવેલ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુક્વવા જણાવ્યું હતું.

દેવાદારો / જામીનદારો / ગીરવેદાર રકમ પરત ચુકવવામાં નિષ્ફળ જતાં આથી દેવાદારો / જામીનદારો / ગીરવેદારો અને જાહેર જનતાને આ નોટિસથી જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે કથિત નિયમોના નિયમ ૩, ૮, ૯ સાથે વંચાતી કાચદાની કલમ 93(૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાની રૂએ નીચે દર્શાવેલી મિલકતનો **તારીખ ૨૯.૦૧.૨૦૨૨ ના રોજ કબજો** લઈ લીધો છે.

આથી ખાસ કરીને દેવાદારો / જામીનદારો / ગીરવેદાર અને જાહેર જનતાને મિલકત સાથે કોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ સોદો ઇન્ડિયન બેંક (ઇ-અલાહાબાદ બેંક), હિલ ડ્રાઇવ ભાવનગર શાખાની તા. ૧૯.૦૪.૨૦૨૧ મુજબની ૨કમ રૂા. ૧૪,૪૧,૦૧૮.૦૦ (રૂપિયા ચૌદ લાખ એકતાળીસ હજાર અઢાર પુરા) અને તેના પરના ભવિષ્યના વ્યાજ અને ખર્ચાના ચાર્જને આદ્યિન રહેશે .

સિક્ચોર્ડ મિલકતો પરત મેળવવા માટે ઉપલબ્ધ સમય અંગે કાયદાની કલમ ૧૩ની પેટા ક્લમ (૮)ની જોગવાઈ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

સ્થાવર મિલકતનું વર્ણન

ગુજરાત રાજ્યમાં આદર્શ સોસાયટી, વિજયરાજનગર, ભાવનગર ખાતે વોર્ડ નં. ૭ની શીટ નં.૨૦૨, સિટી સર્વે નં.૫૬૮૪ પૈકી ધરાવતી આદર્શ સીએચએસમાં પ્લોટ નં.૮૮ પર બંધાચેલ સુમતી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લો૨ ૫૨ ૬.૭૬ ચો.મી.માપના માળીચા અને ૧૦.૮૭ ચો.મી. . માપની દૂકાન નં. ૪/પી (દૂકાન નં. ૪/એ તરીકે જાણીતી)ની સ્થાવર મિલકતના તમામ પીસ અને પાર્સલ. ચતુ:સીમા : પૂર્વ : બોડાચેલ રોડ, પશ્ચિમ : દુકાન નં. ૪/પી (દુકાન નં. ૪/એ ਰਦੀਤੇ ਆਈਰੀ), **ઉत्तर :** ਐਤ। येલ ਦो 5, **દक्षिश :** हुङान नं. २ अने 3

હાઇપોથીકેટેડ મિલકતો : સમગ્ર સ્ટોક, ચોપડે દેવાઓ અને પેઢીની વર્તમાનની અને ભવિષ્ય બંનેની અન્ય તમામ ચાલુ મિલકતો પરનું વિશિષ્ટ હાઇપોથીકેશન. ચીફ મેનેજર અને અધિકૃત અધિકારી તારીખ : ૨૯.૦૧.૨૦૨૨

ઇન્ડિચન બેંક (ઈ-અલાહાબાદ બેંક) વતી

અદાણી હાઉસિંગ ફાચનાન્સ પ્રાઇવેટ લીમીટેડ વતી અધિકૃત અધિકારી

ભાષાંતરમાં ગ્રુટી અથવા વિસંગતતા હશે તો અંગ્રેજી સંસ્કરણ માન્ય રહેશે.

દેવુભાઇનું ઘર, દક્ષિણ : સાજનબેન ઉદેસિંહનું ઘર

GRP Limited

નાં રોજ

31. 6,36,463.00/-

સહી/-

N. K. Industries Limited Registered Office: 7th Floor, Popular House, Ashram Road Ahmedabad - 380 009.

56100 : 041091215

(CIN: L25191GJ1974PLC002555) Registered Office : Plot No.8, GIDC Estate, Ankleshwar - 393 002 Dist. Bharuch, Gujarat

મોજે– નેશ હાઉસ નં. ૨૯૨, ક્ષેત્રફળ ૪૮૦ ચો. મી. તાલુકો–ઠાસરા, જિલો–ખેડા ૨૪ જાન્યુઆરી, ૨૨

ખાતેની મિલક્તના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સૌમા : પુર્વ : રામસિંહ ૨૪ જાન્ચુઆરી, ૨૨

જીવંતસિંહનું ઘર, પશ્ચિમ : ભીખાભાઇ બેચરભાઇનું ઘર, ઉત્તર : અજીતભાઇ

તમે દેવાદાર/રોઅને સ૯-દેવાદારો/જામીનંદારોને આથી આ નોટીસ મળઅાથાની તારીખથી ૬૦ દિવસની અંદર ઉપર જણાવેલ માંગણાની બાકી સ્કમ તેમજ્યંડત વ્યાજની યુક્વણી કરવા જણાવામ આવે છે, તેમાં બિષ્ડળ જાતું નીચે સહી કરવારને ઉપર જણાવેલ સિક્યોરેટીઝને ટાંચમાં તેવા માટે એકટ હેઠળ પગલાં તેવાની કરવા જણાવામાં તાવારે વાત્ત કચાવો દોરવામાં આવે બેન્જા ઉપયોગથી તમે સરદુર્લ જોગવાજીમાં જામાંતેલ સમયગાળા દરમિયાને સિક્યોર્ડ એસટ પ કલમ ૧૩ (૧૩) હેઠળ, અમારી આગોતરી મંજુરી વગર, ઉપર જણાવેલ સિક્યોરેટીઝનો વેચાણ, વીઝ અથવા અન્ય રીતે ત્યાને વાત્માં કર કલમ ૧૩ (૧૩) હેઠળ, અમારી આગોતરી મંજુરી વગર, ઉપર જણાવેલ સિક્યોરેટીટો જોગ થયા અન્ય રીતે તબદીલી કરવાની તમાંત્રે મનથ કલમ ૧૩ (૧૩) હેઠળ, અમારી આગોતરી મંજુરી વગર, ઉપર જણાવેલ સિક્યોરેટીઝનો વેચાણ, વીઝ અથવા અન્ય રીતે તબદીલી કરવાની વખી મનથા કરવા અન્ય કરવા અવા છે કરવા છે કરવા લો છે કરવા છ

Tel no.: 022 67082600 / 2500, Fax: 022 67082599, e-mail id : investor.relations@grpweb.com, website: www.grpweb.com

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31st DECEMBER, 2021

(₹ in L							(₹ in Lakhs)
			Standalone			Consolidated	
Sr		Quarter ended		Nine months ended	Quarte	Nine months ended	
No.	Particulars	31-12-2021	31-12-2020	31-12-2021	31-12-2021	31-12-2020	31-12-2021
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited
1	Total Income from Operation (Net)	9,330.54	8,456.41	27,667.53	9,341.96	8,463.85	27,719.56
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	106.19	233.45	336.89	108.04	233.91	335.28
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	106.19	233.45	336.89	108.04	233.91	335.28
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	77.56	164.26	346.91	79.00	164.17	344.10
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	98.47	196.99	307.50	99.91	197.91	305.08
6	Equity Share Capital	133.33	133.33	133.33	133.33	133.33	133.33
7	Other Equity (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	÷	-	-	-
8	Earnings Per Share (of ₹ 10/- each) (for continuing and discontinued operations) (*Not Annualised)						
	1. Basic : (in ₹)	5.82 *	12.32 *	26.02 *	5.93 *	12.31 *	25.81 *
	2. Diluted : (in ₹)	5.82 *	12.32 *	26.02 *	5.93 *	12.31 *	25.81 *

મહેશકુમાર મનુભાઇ રાવલજી /

રિટાબેન મહેશકુમાર રાવલજી

8000HL001020312/

સ્થળ : ગજરાત

તારીખ : ૦૨.૦૨.૨૦૨૨

NADAHL000010512

The above is an extract of the detailed format of Quarterly/ Nine months ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/ Nine months ended Financial Results are available on the Stock Exchange websites (www.nseindia.com & www.bseindia.com) and on the Company's website (www.grpweb.com).

The above results have been reviewed by the Audit committee and approved by the Board of Directors at their meeting held on 31st January, 2022.

Figures for the previous period are regrouped/reclassified wherever necessary, to make them comparable.

We'll take vou home

Place : Mumbai

Date : 31st January, 2022

FOR GRP LIMITED HARSH R. GANDH JOINT MANAGING DIRECTOR

This intimation is also available or

Company's website: www.ibfindia.com

nd also on stock exchanges website

Mrs. Ujjwala Apte (Company Secretary)

w bseindia com and www.nseindia.com

For JBF Industries Limited



905, Ph.: +91-79-6630 999

Extracts of unaudited Standalone and Consolidated Financial Results for the quarter ended on 31st December, 2021

અધિકૃત અધિકારી

એક્સીસ બેંક લીમીટેડ

						(Rs. In lacs
		Standalone Consolidated				
Particulars	Quarter ended	Quarter ended	Year ended	Quarter ended	Quarter ended	Year ended
	31/12/2021	31/12/2020	31/03/2021	31/12/2021	31/12/2020	31/03/2021
Total income from operations (net)	70.74	40.66	282.69	525.36	521.94	2256.66
Net Profit/(Loss) (before Extraordinary activities after tax)	(51.83)	(132.30)	(232.38)	(36.63)	(163.71)	(226.13)
Net Profit/(Loss) for the period after tax (after Extraordinary items)	(51.83)	(132.30)	(232.38)	(36.63)	(163.71)	(226.13)
Equity Share Capital	600.99	600.99	600.99	600.99	600.99	600.99
Earnings Per Share (before extraordinary items) of Rs.10/- each Basic: Diluted:	(0.86)	(2.20)	(3.87)	(0.61)	(2.79)	(3.76)
Earnings Per Share (after extraordinary items) of Rs.10/- each Basic: Diluted:	(0.86)	(2.20)	(3.87)	(0.61)	(2.79)	(3.76)

Note:

The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Quarterly Financial Results are available on the Stock Exchange websites. (URL: http://www.bseindia.com/corporates/ann.aspx?scrip=519494&dur=A&expandable=0)

> For and on behalf of Board of Directors **N. K. Industries Limited** Sd/-Mr. Nimish K. Patel **Managing Director**

Date: 1st February, 2022

Place: Ahmedabad

Home First Finance Company India Limited,

CIN:U65990MH2010PTC240703

Website: homefirstindia.com, Phone No.: 180030008425, Email ID: loanfirst@homefirstindia.com

NOTICE OF SALE THROUGH PRIVATE TREATY

Sale of Secured assets under Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 – (Notice Under Rule 8 (6))

The undersigned as Authorized Officer of Home First Finance Company India Limited (Home First) has taken over possession of the schedules property, in terms of section 13(4) of the subject act in connection with outstanding dues payable by you to us. Please refer our Notice dated mentioned below, wherein we informed that we have published Auction Notice in the newspaper mentioned by fixing the Reserve Price as mentioned. The Auction was scheduled on the date as mentioned. The Auction could not be successful due to lack of any bidder.

Public at large is informed that the secured property(ies) as mentioned in the Schedule are available for sale through Private Treaty, as per the terms agreeable to the Company's dues on "AS IS WHERE IS BASIS" and "AS IS WHAT IS BASIS". Hence, in terms of the provisions of the subject Act and Rules made thereunder, we issue this notice to you to enable you to discharge the amount due to the Company within 15 days from the date of this notice and take back the assets mentioned in the schedule, failing which the assets will be sold to discharge the liabilities. This is without prejudice to any other rights available to the Company under the subject Act or any other law in force.

The interested parties may contact the Authorized Officer for further details/ clarifications and for submitting their offers. Sale shall be in accordance with the provisions of SARFAESIAct / Rules

Sr. No	Name of the Account/ Guarantors	Details of property/ owner of the property	Outstanding amount as on Demand Notice (in INR)	Date of Sale Notice	Newspaper	Date of e-Auction	Reserve Price (in INR)	No. of Authorised Officer
1	Shivanidevi Rakesh Saw, Rakesh Saw	Flat No. 405, Yogi Villa, Block No 526/1 , Plot no 1 to 3, Yogi Darshan society, Besides Megha Plaza, Palsana chaukdi, Tal: Palsana Surat Gujarat 394315	1,105,060	13-Jan-22	Financial Express (Eng + Guj)	29-Jan-22	941,600	8238994548

STATUTORY 15 DAYS SALE NOTICE UNDER THE SARFAESI ACT, 2002

The borrower/ guarantors are hereby notified to pay the sum as mentioned in the demand notice along with upto date interest and ancillary expenses before 15 days from the date of this notice, failing which the property will be auctioned/ sold and balance dues, if any, will be recovered with interest and cost Signed by Authorized Officer, Home First Finance Company India Limited Date: 02/02/2022, Place : Surat.